

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૦૩/૨૦૧૫ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૦૫/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૫ કેસ કરી ૧૨ વ્યક્તિઓને ઝડપી, ૭૬ લીટર દેશી દારૂ, ૧૨૩ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪૮૦ બિયર ટીન, ૦૧ મોટર સાયકલ અને ૦૨ ઓટોરીક્ષા કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૬૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યાં હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૦૬/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૨૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

અપહરણ:-

સમાચાર યાદી નં.૬૦૭/૧૫

સોલા હાઇકોર્ટ : પુજાબહેન મનસુખભાઈ ઠાકોર (ઉ.વ.૧૬)(રહે.જનતાનગર ફાટક પાસે, ચાણક્યપુરી ઘાટલોડીયા) ને તા.૭/૩/૧૫ કલાક ૪/૦૦ વાગ્યા પહેલાં કોઇપણ સમયે ઘર નજીકથી આરોપી પ્રવિણભાઈ પ્રહલાદભાઈ દંતાણી (રહે.મકરબા) લગ્ન કરવાની લાલચ આપી, આરોપી મહેશ ઉર્ફે લાલો ગણપતભાઈ રાઠોડ ની મદદગારીથી લલચાવી ફોસલાવી ભગાડી લઇ ગયો છે. આ અંગેની ફરીયાદ પુજાબહેનની માતા મંજુલાબહેન ઠાકોરે તા.૨૭/૩/૧૫ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.બી.સૈયદ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૬૦૮/૧૫

સરદારનગર : જીતેન્દ્રભાઈ લક્ષ્મીચંદ મલાણી (રહે.જવાહર કોલોની આદર્શ બંગ્લોઝની સામે, સરદારનગર) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા.૨૬/૩/૧૫ નાં કલાક ૧૧/૦૦ થી તા.૨૭/૩/૧૫ સવાર ૭/૩૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૯૪,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી દિપક બાજીરાવ ચલાવે છે.

ઓઢવ : સંજીવ રાઘેશ્યામ ગુપ્તા (રહે.સમાજ નવ રચના સોસાયટી, ખોડીયારનગર) એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે તા.૨૬/૩/૧૫ રાતનાં ૧૦/૦૦ થી તા.૨૭/૦૩/૧૫ સવારનાં ૬/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોનાના દાગીના કિંમત રૂપિયા ૬૯,૦૦૦/- અને રોકડ રૂપિયા ૩૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૦૪,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એ.આર.જનકાંત ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૬૦૯/૧૫

સોલા હાઇકોર્ટ : ડૉ.શૈફાલીબહેન જનકભાઈ દેસાઈ (રહે.હેરીટેજ રેસીડન્સી, થલતેજ) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે પોતાના ઘરમાં કામ કરતો આરોપી હિતેષ મારવાડી (મુળ વતન : ડુંગરપુર, રાજસ્થાન) તા.૨૭/૩/૧૫ સવારનાં ૧૦/૦૦ થી સાંજનાં ૫/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરનાં કબાટનું તાળુ તોડી, કબાટમાંથી રોકડ રૂપિયા ૧,૯૦,૦૦૦/- ચોરી કરી નાસી ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.કે.અસોડા ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૬૧૦/૧૫

ઓઢવ : ભરતભાઈ સોનમલ શાહ (રહે.મધુરમપાર્ક સોસાયટી, ગીતાગૌરી સીનેમાની બાજુમાં, ઓઢવ) એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૭/૩/૧૫ સવારના ૮/૦૦ વાગ્યાના સુમારે ભરતભાઈના માતા ભુરીબહેન (ઉ.વ.૮૦) રાજેન્દ્રપાર્ક ઓવરબ્રીજનાં છેડે રાજરત્ન સોસાયટીનાં કોમન પ્લોટની સામેથી ચાલતાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે.૨૦.ટી.૫૧૯૯ ના ચાલકે ટ્રક પુરઝડપે અને બેદરકારીથી ચલાવી લાવી, ભુરીબહેનને ટક્કર મારતાં, ટ્રકનું ટાયર ભુરીબહેન ઉપર ફરી ફળતાં તેમનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હતુ. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.એન.ખાંટ ચલાવે છે.

વટવા : રમેશભાઈ બુધાભાઈ ચૌહાણ (રહે.ધામતવણ, કુંવરબાઈની તલાવડી, પ્રાથમીક શાળા પાસે, તા.દસ્ક્રોઇ, જી.અમદાવાદ) એ તા.૨૭/૩/૧૫ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૫/૩/૧૫ બપોરના ૩/૩૦ વાગ્યાના સુમારે રમેશભાઈના પિતા બુધાભાઈ ચેતલપુર કાર્ગો મોટેર્સ નજીકથી ઓટોરીક્ષામાં બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇશર ગાડી નંબર એમ.જી.૪૬.ઇ.૬૦૯૫ ના ચાલકે આઇશર ગાડી પુરઝડપે અને બેદરકારીથી ચલાવી લાવી, ઓટોરીક્ષાને ટક્કર મારતાં બુધાભાઈને ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતુ. આ ગુનાની તપાસ વટવા પોલીસ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૬૧૧/૧૫

એલીસબ્રીજ : ધર્મેશ નટવરલાલ બેંકર (ઉ.વ.૩૫)(રહે.શ્રધ્ધા ફ્લેટ, મીરા સીનેમા પાસે, મણીનગર) એ તા.૨૭/૩/૧૫ સવારના ૧૧/૪૫ વાગ્યા પહેલાં કોઇપણ સમયે માનશીક તણાવમાં આવી જઈ ચંદ્રનગર બ્રીજ સાબરમતી નદીમાં પડી ડુબી જઈ આત્મહત્યા કરી હતી. આ અંગે એલીસબ્રીજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી ફતેસિંહ રૂપાભાઈ ચલાવે છે.

(ઇ.યા.)નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.